

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,  
બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

<https://gpssb.gujarat.gov.in>

જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક સંવર્ગના ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૨૨-૦૭-૨૦૨૧ ના નોટીફિકેશન નં. KP/ 20/ 2021/ PRR/10/ 2014/106/KH થી પ્રસિધ્ધ કરવામાં આવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો-૨૦૨૧ ની જોગવાઈ અન્વયે રૂબરૂ ઓનસ્ક્રિન જિલ્લા પસંદગી(ફાળવણી) કાર્યક્રમમાં નીચેની વિગતે જે તે તારીખ- સમયે મંડળની કચેરીએ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે. આ અંગે ઉમેદવારોના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અચુક હાજર રહી નીચેની સુચના (૧) થી (૫) મુજબ જિલ્લા પસંદગી કરવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી. વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી છે.

જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ	ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમની તારીખ અને સમય		ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના યાદી અનુક્રમ નંબર (SR.NO)
	તારીખ	સમય	
૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક	૦૧-૧૦-૨૦૨૨	સવારે ૧૧-૩૦ કલાક	૧૪૧૫ થી ૧૪૫૩ (દિવ્યાંગ ઉમેદવારો)
		સવારે ૧૧-૪૫ કલાક	૧૪૫૪ થી ૧૪૫૭ (માજી સૈનિક ઉમેદવારો)
		બપોરે ૧૪-૩૦ કલાક	૧ થી ૧૦૦
		બપોરે ૧૬-૦૦ કલાક	૧૦૧ થી ૨૦૦
	૦૨-૧૦-૨૦૨૨	સવારે ૯-૩૦ કલાક	૨૦૧ થી ૩૦૦
		સવારે ૧૧-૩૦ કલાક	૩૦૧ થી ૪૦૦
		બપોરે ૧૫-૦૦ કલાક	૪૦૧ થી ૫૦૦
		બપોરે ૧૬-૩૦ કલાક	૫૦૧ થી ૬૦૦
	૦૬-૧૦-૨૦૨૨	સવારે ૯-૩૦ કલાક	૬૦૧ થી ૭૦૦
		સવારે ૧૧-૩૦ કલાક	૭૦૧ થી ૮૦૦
		બપોરે ૧૫-૦૦ કલાક	૮૦૧ થી ૯૦૦
		બપોરે ૧૬-૩૦ કલાક	૯૦૧ થી ૧૦૦૦
	૦૭-૧૦-૨૦૨૨	સવારે ૯-૩૦ કલાક	૧૦૦૧ થી ૧૧૦૦
		સવારે ૧૧-૩૦ કલાક	૧૧૦૧ થી ૧૨૦૦
		બપોરે ૧૫-૦૦ કલાક	૧૨૦૧ થી ૧૩૦૦
		બપોરે ૧૬-૩૦ કલાક	૧૩૦૧ થી ૧૪૧૪

ઉમેદવારો માટેની સુચના:-

- (૧) ઉમેદવારે જાતે ઉપરોક્ત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં તેને ફાળવેલ નિયત તારીખ-સમયે અચુક હાજર રહેવાનું રહેશે.
- (૨) ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ફોટો આઇડી પુસ્તક અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
- (૩) કોઇ કારણસર સંબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યક્તિને હાજર રાખી શકશે. સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ

છે તે વ્યક્તિનો ફોટો ચોટાડેલ હોવો જોઈએ અને સદર બંને ફોટા ઉપર સંબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઈએ. સદર અધિકૃત કરેલ વ્યક્તિ ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સંબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે. અધિકૃત કરેલ વ્યક્તિએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરૂપે હોવો જોઈશે.

(૪) ઉમેદવારોને ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી ઉમેદવારના મેરીટ ક્રમાનુસાર ફાઇનલ સીલેક્શન એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં દર્શાવેલી ઉમેદવારની સીલેક્શન કેટેગરી મુજબ ઉમેદવારનો ક્રમ આવે ત્યારે ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવાર/ તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઈએ, અને જો તે સમયે કોઈ ઉમેદવાર/ ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઈપણ દાવો અથવા વિવાદ મંડળ ધ્વારા ગ્રાહ્ય રખાશે નહિ.

(૫) ઉમેદવાર પોતે તેને ફાળવેલ નિયત તારીખ અને નિયત સમયે ઉપરોક્ત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં આવા ઉમેદવારને નોકરી મેળવવામાં રસ નથી, તેમ માની આવા ઉમેદવારની પસંદગી મંડળ ધ્વારા “રદ” ગણવામાં આવશે, અને આ બાબતે મંડળનો નિર્ણય આખરી રહેશે અને ત્યારપછી આ બાબતે કોઈ પણ દાવો/વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

(૬) આ જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ નામ.ગુજરાત હાઇકોર્ટમાં પડતર સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં. ૧૦૯૩૯/૨૦૨૨ તેમજ સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં. ૧૮૧૧૩/૨૦૨૨ના આખરી ચુકાદાને આધીન રહેશે.

સ્થળ:- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી, બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, ડી વીંગ સેક્ટર-૧૦/એ,

ગાંધીનગર

“મંડળના આદેશાનુસાર”

તારીખ: ૧૬/૦૯/૨૦૨૨

સચિવ